

સુર્યભૂતિ
સુરેશ પ્રા. ભક્ત
ફોન: ૨૩૨૨૬૬૭૧

કંચારીઓ લે કરવટ, રખણીઓ કૂકું છે,
મેળ પડવા મોળા, સાહેબો ચ રખણીઓ કૂકું છે,
રખણીઓ કૂકું ખેડૂતો, છે સમયનો તકાદો -
વાગ જેણે સમાજે પણ, રખણીઓ કૂકું છે

ઉદારી હાથી,
કપની સંવાદી -
આનુભુ પાણી...
(મહારાજાની મૂછ નીચી!) (પ્રકૃતિમાં પણ પટ્ટો?!)

દોમ તરફ
વાવાઝોડા - વખંડ
- ને પડ કરા

ટાઈકુ

ચિંતાન

સંસારિક સુધારસકં ભલો અસ્તીનિ વાનિનું ।

કર્મ ખાલો જાણ જાણ્ય તે લાચે દાખણ્ય જાણ ॥

‘એ માલાસ સંસારમાં રીને, સંસાર વ્યાખ્યાનના સુખખેન, ભોગ-વિલાસમાં, આસક્ત રહેતો હોય છતાં પણ પોતાને ‘હું બ્રહ્મકાળી નું’ એમ કહેતો - કેવાળતો હોય તેવા માણસનો તો નીચે કુર્ખન-કુર્ખની જેમ ત્વાગ કરવો; કાશ કે તે તો કર્ખાળના માણસની પણ રહ્યો નથી એને ખ્રિસ્તાનમાં તો તે જ નથી.’

ખૂન-ટૂંક-બોર્ડ-બોર્ડાનો ખોડ જોણા-મેટો આખાતીથી પદારણ થય જતાં ને સ્થાપવા માણસો ‘નાના’ થય જાણ છે આમ જતાં સ્થાપવાની વાત છે પણ સાચું તો છે કે એ પોતાની જાતને જ જીતે છે. પોતે જ પોતાને અંગઠાનો નથી. જીવનનો ત્વાગ કરી સુધીનું સંસાર માંડે છે. આશ્રમ મુશ્વે જોવા જોનાં, ત્વાગ સુધીની બોગ્યા, મોટા વહીવર રહ્યે જોવા હોય, સેકસ કોંબાડ ચાલતાં વાગ છતાં ‘ત્વાગી’ - મહાદેવા ‘બાપુઅનો’ થય પોતાની ખૂન કરવાના હોય છે. આગા ‘નાના’ ના બેંગ જગડે છે. સંસારી થય શકતા નથી અને જાહું રહી શકતા નથી. આમ છતાં દુષ્પિત લોકો ‘નિમિત્ત’ હોવાના પેંત્રા રસી નિષ્ઠાનો અંક્રમ કરે છે. આગા સાધુ-સંત-બાળા-બાપુઅનો કોટ નીચે-કુર્ખન-કુર્ખની જેમ ત્વાગ કરવો.

સુવિચાર

- એ કર્મ કરીએ છીએ તેની આસક્ત ક્રમાં કરી જતી નથી પણ તેના સંસ્કાર સાથે પોતાની જીવ મુંકું જથ છે, બીજાના જીવન પર તેની આસક્ત પર્દ છે - દીપોદેશ
- એ બીજાના કામનાં ચિંતા નથી કરતો તે આયમ સાથે શાંતિ પણ લોગવે છે - નાનોવર્કીની શેષકારી
- આપણી જીવના જીવની જ ગાનાનિક કર્મજીને કરાયે જ હોય છે - જોઈ
- એ દેંગ સભ્યનું પાલનપોથી કરે છે તે તું સાધુ-સંત-સંજાનનું નાની છે? એમ વિચારી ત્વાગ સંત નિષ્ઠિત રહે છે - જોસા. બાધાર્ય
- જીવની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા
- બીજાને ખૂબ કરવા માટે પહેલાં જતે ખૂબ થતું જેણે

બોધકથા

નેતા હોય - પ્રધાનો હોય કે સરકારી બાબુ જેમની રૂગમાં આવકીનું લોહી ફૂરે છે એ ગમે ત્વાગી જેમ તેમ બાધકી કરવાના જ, લાંબાપાણ આવે કે તેના પિતાશી, કોઈ જેના પર અંકુંની મુંકું જાદે, કાદાન પહેલાં કાંદાન તૈયાર જ હોય છે. માતૃત્વના સાચિક સંકાર જ માણસની સુધારી શકે..

સ્થાન સાચિયાની રાખાના આખામાં દાખારે એ કે નાન મુકુાવી ગ્રામપણો અને આવતા-જતાં માટે પરનીની લેવા જીવી કરી હોય.

એકવાર વહીની સાવારે, સ્વામી ક્રવા જતા હોય કે એક દુંઘાળો પોતાના કુદ્દ લયાર્ય કેનાની નામનાંથી પાણી જરી દૂધને ‘માલદી’ કરતો હોય. સ્વામીનું નજીક વજે એ મેં વિચારી ત્વાગ સંત નિષ્ઠિત રહે છે - જોસા.

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતાનો બોજ રાખવો એ પોતાની પિંડ પર બાંસીની બાંસીને - હેલી જરૂરન - જોસા

સ્વાત્માની વધતી પણ મન પર ચિંતા